

પુનરાવર્તન - 1 (Revision - 1)

ક્ર. 1 તમારી આસપાસ જોવા મળતાં હોય અને બરચાંને જન્મ આપે છે તેવાં પ્રાણીઓની યાદી બનાવો.

ક્ર. 2 હાથી અને મશરૂ વચ્ચે શું સમાનતા છે ?

હાથી	મશરૂ
_____	_____
_____	_____
_____	_____
_____	_____
_____	_____

ક્ર. 3 ચોમાસામાં ખાસ જોવા મળતાં પ્રાણીઓની યાદી બનાવો.

પ્ર.4 આંકૃતિકોરો:

કાપાર્શ તારાજૂથ

શર્મિષ્ઠા તારાજૂથ

મૃગ તારાજૂથ

પ્ર.5

શું જેધો ? નાની થાળી, લખોટીઓ

શું કરીશું ?

- ☞ એક થાળી લો. તેને લખોટીઓથી પૂરેપૂરી ભરો.
 - ☞ થાળીને હાથ વડે થોડી હલાવી જુઓ.
 - ☞ લખોટીઓના સ્થાનમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તેનું અવલોકન કરો.
 - ☞ હવે તેમાંથી અર્ધી લખોટીઓ કાઢી લો.
 - ☞ થાળીને ફરી વાર હાથ વડે હલાવી જુઓ.
 - ☞ લખોટીઓના સ્થાનમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તેનું અવલોકન કરો.
 - ☞ હવે થાળીમાં માત્ર ત્રણ-ચાર લખોટી રહેવા દઈ બાકીની લખોટીઓ કાઢી લો.
 - ☞ થાળીને હાથ વડે હલાવી જુઓ.
 - ☞ લખોટીઓના સ્થાનમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તેનું અવલોકન કરો.
 - ☞ તમારા ત્રણોય વખતના અનુભવોને ધન, પ્રવાહી અને વાયુ-સ્વરૂપની આણુગોઠવણી સાથે કઈ રીતે સાંકળી શકાય?
-
-
-
-

પ્ર.6


“પદ્ધાર્થને ગરમી આપવાથી કે ગરમી શોષવાથી તેના સ્વરૂપમાં ફેરફાર થાય છે.” તેની સમજૂતી તમે જાણતા હો તેવા કોઈ ત્રણ ઉદાહરણોની મદદથી આપો.

પ્ર.૭ નીચેની પ્રવૃત્તિ કરો અને અવલોકન નોંધો :

શું જોઈશો ? કાર્ડ પેપર, કાતર, મીણબત્તી

શું કરીશું ?

- ☞ એક કાર્ડ પેપર લો.
 - ☞ આકૃતિમાં બતાવ્યા મુજબ કાપો.
 - ☞ એક કાર્ડ પેપરની જે વર્તુળાકાર રિંગ બને તેની વચ્ચે ટાંકણી ખોસો.
 - ☞ હવે મીણબત્તી સળગાવો.
 - ☞ વર્તુળાકાર રિંગને મીણબત્તી ઉપર થોડે ઊંચેથી પકડો અને અવલોકન નોંધો.
 - ☞ વર્તુળાકાર રિંગ ગોળ ગોળ કેમ ફરે છે ?
-
-
-
-



પ્ર.૮ વિચારિને લખો :

(1) લુહાર ગાડાના પૈડા પર લોખંડની વાટ ગરમ કરીને ચઢાવે છે અને પછી તેના પર દુંદું પાણી રેઠે છે. શા માટે ?

(2) તવી સાથે લાકડાનો હાથો હોય તો શો ફાયદો થાય છે ?



(3) એક તપેલીમાં ચા ઊકળે છે. તેમાં ઉષ્માનું સંચરણ કર્દી કર્દી રીતે થયું ? શા માટે ?

